

શાંતિલાલ શાહ એન્જી.કોલેજ, ભાવનગર

વર્ષ ૨૦૧૭ માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટેની સૂચના

રીપોર્ટિંગ તથા રજીસ્ટ્રેશન નો સમય ૧૧-૦૦ થી ૫-૦૦ રહેશે.

આપે, આ કોલેજમાં પ્રથમ વર્ષમાં મેળવેલ પ્રવેશ બદલ અભિનંદન સહ આવકારીએ છીએ. આ કોલેજમાં રીપોર્ટિંગ તથા રજીસ્ટ્રેશન માટે આવો ત્યારે નીચે મુજબ ની વિગતો ધ્યાને લેવા વિનતી છે.

- (૧) એડમિશન કમિટી દ્વારા પ્રવેશ ફાળવાયા બાદ સૌ પ્રથમ વિદ્યાર્થી એ પોતાનો પ્રવેશ ઓનલાઇન કન્ફર્મ કરી ફી જમા કરાવવાની રહેશે. વધુ વિગતો માટે એડમિશન કમિટી ની વેબસાઇટ જોવા મળશે.
- (૨) ઉપરોક્ત પરિપત્ર માં જણાવ્યા પ્રમાણે એડમિશન કન્ફર્મ કરાવી સંસ્થા ખાતે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ ની અસલ તથા એક નકલ સાથે હાજર રહેવું. .
 - (a) Admission Slip
 - (b) Information Letter
 - (c) બેંક ચલણ/ઓનલાઇન ફી ભર્યા ની પહોંચ
- (૩) હાલ સંસ્થા ખાતે કોઈ પ્રકાર ની ફી ભરવાની રહેતી નથી. અભ્યાસનું સત્ર તા. ૦૩/૦૮/૨૦૧૭ થી શરૂ થયા બાદ સંસ્થા ખાતે ભરવાની થતી ફી તથા માર્કશીટ/પ્રમાણપત્રો ની નકલો જમા કરાવવા નો કાર્યક્રમ જાહેર કરવા માં આવશે.
- (૪) સંસ્થા ભાવનગર શહેર થી આશરે ૧૨ કિમી. ના અંતરે સીદસર-બુઘેલ રોડ પર સીદસર ગામથી આશરે બે કિમી દૂર આવેલ છે. નકશા માં જોવા માટે નીચે ની લીંક ઓપન કરશો.

<https://www.google.co.in/maps/@21.7040468,72.1261656,15z>

સંસ્થા ખાતે પહોંચવા માટે,
 - a) શહેર ના સંસ્કાર મંડળ ચાર રસ્તા પાસેથી શટલ રિક્ષા ઉપલબ્ધ થઇ શકે છે.
 - b) અમદાવાદ કે રાજકોટ તરફથી આવતા વિદ્યાર્થીઓ માટે શહેર ના ચિત્રા વિસ્તાર માં આવેલ મસ્તરામ બાપા મંદિર પાસે થી સીદસર આવવા માટે સીટી બસ/શટલ રિક્ષા મળી શકે છે જ્યાંથી બીજી રિક્ષા માં કોલેજ પહોંચી શકાય.
 - c) શહેર ના એસ.ટી. બસ સ્ટોપ તથા રેલ્વે સ્ટેશન નજીક આવેલ ગંગાજળીયા તળાવ ખાતે આવેલ બંસી ની સિટીબસ ના મુખ્ય બસ સ્ટોપ થી પણ સીદસર આવવા માટે સીટી બસ મળી શકે છે. જ્યાંથી બીજી રિક્ષા માં કોલેજ પહોંચી શકાય.
- (૫) સંસ્થા ખાતે બોયઝ હોસ્ટેલ ની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ ની અરજી આવે તેવા કિસ્સામાં મેરીટ ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. ગર્લ્સ હોસ્ટેલ ની સુવિધા સંસ્થા ખાતે ઉપલબ્ધ નથી. હોસ્ટેલ માં પ્રવેશ ના મેળવી શકનાર વિદ્યાર્થીઓ માટે તેમજ વિદ્યાર્થીનીઓ માટે સીદસર ગામ તેમજ ભાવનગર શહેર માં પેઈંગ ગેસ્ટ ની સુવિધા ઉપલબ્ધ હોય છે.